

વિંગ્સ શુલ્કનું સમયપત્રક ૧ જૂન,
૨૦૨૫ થી અમલમાં



વિશેષતાઓ#		માપદંડ અને શુલ્ક
સરેરાશ માસિક બેલેન્સ (AMB) - મેટ્રો અને શહેરી		રૂ. ૫૦,૦૦૦ અથવા રૂ. ૨,૦૦,૦૦૦
સરેરાશ માસિક બેલેન્સ (AMB) - અર્ધ શહેરી અને ગ્રામીણ		રૂ. ૨૫,૦૦૦ અથવા રૂ. ૨,૦૦,૦૦૦
AMB બિન જાળવણી શુલ્ક		શૂન્ય
ચેક ભુક		મફત
ક્રોમ્પેલમેન્ટરી એર એક્સિડેન્ટલ ડેથ કવર (ઇન્ડેવિજયુઅલ) (નોંધણી પર)^~		રૂ. ૩૦ લાખ
ક્રોમ્પેલમેન્ટરી પર્સનલ એક્સિડેન્ટલ ડેથ કવર (ઇન્ડેવિજયુઅલ) (નોંધણી પર)^~		રૂ. ૧૦ લાખ
ક્રોમ્પેલમેન્ટરી પર્સનલ ટોટલ ડિસેમિલિટી કવર (ઇન્ડેવિજયુઅલ) (નોંધણી પર)^~		રૂ. ૧૦ લાખ
ક્રોમ્પેલમેન્ટરી હોમ બલ્ગરી (કન્ટેન્ટ) એન્ડ ફાયર (કન્ટેન્ટ) કવર (નોંધણી પર)^~		રૂ. ૨ લાખ
લોકલ ડિસ્કાઉન્ટ		૨૫%
આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડ**		
ડેબિટ કાર્ડની પસંદગી**		વિંગ્સ પ્લેટિનમ
જારી કરવાની ફી (પ્રથમ વર્ષ)		શૂન્ય
ફરી જારી કરવાની ફી		રૂ. ૨૫૦
વાર્ષિક જાળવણી શુલ્ક (બીજા વર્ષ પછી) ** પહેલાના ૧૨ મહિનામાંથી ૬ મહિના માટે રૂ. ૫૦,૦૦૦ ની AMB અથવા રૂ. ૨,૦૦,૦૦૦ ની TRV જાળવવા પર મુક્તિ આપવામાં આવી છે		રૂ. ૨૫૦ પ્રતિ વર્ષ
દૈનિક રોકડ ઉપાડ મર્યાદા (એટીએમ)		રૂ. ૧.૫ લાખ
દૈનિક ખરીદી મર્યાદા (કલ્પજ અને ઓનલાઇન)		રૂ. ૩ લાખ
ઇક્યુઇટાસ એટીએમમાંથી રોકડ ઉપાડ - ભારત***		મફત
નોન ઇક્યુઇટાસ એટીએમનો ઉપયોગ - નાણાકીય વ્યવહારો-ભારત		૮ મફત; મફત મર્યાદાથી વધુ - રૂ. ૨૩/- પ્રતિ વ્યવહાર
નોન ઇક્યુઇટાસ એટીએમનો ઉપયોગ - બિન નાણાકીય વ્યવહારો-ભારત		૮ મફત; મફત મર્યાદાથી વધુ - પ્રતિ વ્યવહાર રૂ. ૧૨/-
નોન ઇક્યુઇટાસ એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નક્કરું		પ્રતિ વ્યવહાર રૂ. ૧૦
ધરેલુ ફ્યુલ ફીલિંગ સ્ટેશન પર ફ્યુલ સરચાર્જ#		શૂન્ય
રિવોર્ડ પોઇન્ટ્સ (કલ્પજ સ્પેન્ડ)		૧૫૦/- ના ખર્ચ પર ૨ પોઇન્ટ
રોકડ ઉપાડ (ભારતની બહાર)****		પ્રતિ વ્યવહાર રૂ. ૧૧૦/-
બેલેન્સ પૂછપરછ (ભારતની બહાર)****		પ્રતિ વ્યવહાર રૂ. ૨૫/-
ચુકવણીની સેવા		
RTGS ઇનવર્ડ		મફત
NEFT ઇનવર્ડ		મફત
IMPS ઇનવર્ડ		મફત
RTGS આઉટવર્ડ		મફત
NEFT આઉટવર્ડ		મફત
IMPS આઉટવર્ડ (પ્રતિ દિવસ મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦)		૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ.૨.૫/-, રૂ.૫૦૦૦૦૦- રૂ.૧ લાખ: રૂ.૫/-, રૂ.૧ લાખથી વધુ: રૂ.૭.૫/-
PAP ચેક વડે ચુકવણી		મફત
ડિમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડર (ESFB શાખા ખાતે)		પ્રતિ મહિને ૧૦ હીડી સુધી મફત
પ્રતિ મહિને ૧૦ થી વધુ શુલ્ક (ESFB શાખા ખાતે)		પ્રતિ હીડી રૂ. ૫૦
ડિમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડર (બિન ESFB શાખા ખાતે)		પ્રતિ હીડી રૂ. ૧૦૦
ક્રિલિયરિંગ અને કલેક્શન શુલ્ક		
સ્થાનિક ચેક ક્રિલિયરિંગ		મફત
અન્ય બેંકના ચેક કલેક્શનનું શુલ્ક		૫૦૦૦ સુધી- ૨૫ રૂપિયા; ૫૦૦૦ થી ઉપર અને ૧૦,૦૦૦ સુધી- ૫૦ રૂપિયા; ૧૦,૦૦૦ થી ઉપર અને ૧,૦૦,૦૦૦ સુધી- ૧૦૦ રૂપિયા ; ૧૦૦,૦૦૦ થી ઉપર - ૧૫૦ રૂપિયા
રોકડ વ્યવહારો		
રોકડ જમા કરવાની ફી ની મર્યાદા (શાખા અને એટીએમ) - ઇક્યુઇટાસની કોઈપણ શાખા		દર મહિને રૂ. ૨,૫૦,૦૦૦ સુધી મફત
રૂ. ૨.૫ લાખથી વધુ રોકડ જમા કરવાં શુલ્ક (હોમ અને નોન-હોમ બ્રાન્ચ)		રૂ. ૫/૧૦૦૦
બિન-રહેઠાણ સ્થળે રોકડ ઉપાડ		મફત
રહેઠાણ સ્થળે રોકડ ઉપાડ		અમર્યાદિત
અન્ય બેંકિંગ સેવાઓ		
ઓનલાઇન ચુકવણી રોકી દે		મફત અમર્યાદિત
શાખામાં ચેક્કી ચુકવણી રોકી દે		રૂ. ૧૦૦
શાખામાં ફૂલ ચેક ભુક્તી ચુકવણી રોકી દે		૨૫ ચેકની સિરીઝ માટે રૂ. ૧૫૦
ટેકનિકલ કારણોસર ઇનવર્ડ/આઉટવર્ડ ચેક રીઝર્નના શુલ્ક		મફત
ટેકનિકલ કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્નના શુલ્ક		મફત

નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	૨ ચેક સુધી ૫૦૦ રૂપિયા, ત્રીજા ચેકથી ૭૫૦ રૂપિયા
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	૭૫ રૂપિયા પ્રતિ ચેક
RD માટે સ્થાયી સૂચનાઓ	મફત
SIP માટે સ્થાયી સૂચનાઓ	મફત
બિલ ચુકવણી માટે સ્થાયી સૂચનાઓ	મફત
સ્થાયી સૂચનાઓ નિષ્ફળતા (રીઝર્વ)	૧૫૦ રૂપિયા પ્રતિ રિઝર્વ
નાણાકીય કારણોસર ECS/NACH રિઝર્વ	૨૦૦ રૂપિયા પ્રતિ રિઝર્વ
SMS ચેતવણીઓ	મફત
ફોરેન એક્સચેન્જ માર્ક-અપ ^૧	૩.૫%
બેલેન્સ પ્રમાણપત્ર ઓનલાઇન	મફત
શાખામાં બેલેન્સ પ્રમાણપત્ર	મફત
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ - ઓનલાઇન મફત	મફત
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ (ભૌતિક નકલ)	દર વર્ષે ૧ મફત, ત્યારબાદ પ્રતિ સ્ટેટમેન્ટ રૂ. ૩૦૦
પાસબુક જારી કરવી	મફત
સહીની ચકાસણી પ્રમાણપત્ર / ફોટો પ્રમાણિત / સરનામાની પુષ્ટિ	પ્રતિ વખત રૂ. ૫૦
ડ્રુપ્લિકેટ TDS પ્રમાણપત્ર	રૂ. ૧૫૦
ડ્રુપ્લિકેટ એક્સાઉટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઇમેઇલ પર)	મફત
ડ્રુપ્લિકેટ એક્સાઉટ સ્ટેટમેન્ટ (પ્રિન્ટ/હાર્ડ કોપી)	રૂ. ૫૦
DD/PO પુનઃમાન્યીકરણ/રદ્દીકરણ	રૂ. ૧૦૦
ખાતું ખોલ્યાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ કરતા પહેલા ગ્રાહકની વિનંતી પર બંધ કરવામાં આવે તો ખાતું બંધ કરવાના શુલ્ક	રૂ. ૫૦૦

ડેરસ્ટેપ બેંકિંગ^{###}

ચેક પિકઅપ (કોલ પર)	પ્રતિ વખત રૂ. ૫૦
ચેક પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	રૂ. ૩૦૦

કેશ પિકઅપ બીટ^{###} (દર મહિને શુલ્ક)

રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
રૂ. ૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦	રૂ. ૫૦૦૦
રૂ. ૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦૦૦૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો

કેશ પિકઅપ બીટ^{###} (દર મહિને શુલ્ક)

રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૧૫૦
રૂ. ૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦	રૂ. ૩૦૦
રૂ. ૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	રૂ. ૫૦૦
રૂ. ૫૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦૦૦	રૂ. ૮૦૦
રૂ. ૨૦૦૦૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો

*TRV (કુલ સંબંધ મૂલ્ય) માં સરેરાશ માસિક બચત, સેલરી એક્સાઉટની બેલેન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટની રકમ શામેલ છે

**ELITE ડેબિટ કાર્ડ ફક્ત ELITE ગ્રાહકોને જ જારી કરવામાં આવે છે, જો ગ્રાહક હવે ELITE પ્રોગ્રામ સ્ટેટસ ધરાવતા નથી તો રૂ. ૬૦૦ ચાર્જ લાગુ પડે છે.

***બેંકના નિયમો અને શરતો અનુસાર ઉપયોગને આધીન

****ઇન્ડિયન બેંક ભારતની બહાર રોકડ ઉપાડ માટે કોઈ શુલ્ક વસૂલશે નહીં, જોકે એટીએમ સેવાઓ પ્રદાન કરતી બેંક / વિદેશી સંસ્થાઓ દ્વારા શુલ્ક વસૂલવામાં આવી શકે છે.

#આપવામાં આવતી સુવિધાઓ અને લાભો બેંકના સંપૂર્ણ વિવેકબુદ્ધિથી ગ્રાહકને સૂચના આપ્યા વિના / નોંધ આપ્યા વિના બદલાઈ શકે છે.

^૧નિયમો અને શરતો લાગુ, ઇન્સ્ટન્ટ બેંકિંગ / મોબાઇલ બેંકિંગ દ્વારા નોંધણી પર મફત ઇન્વોયરન્સ ક્વર મેળવી શકાય છે.

~દાવાની પતાવટ વીમા રક્ષાની મહત્તમ રકમ સુધીની હશે.

^{xx}શાખાએ લોકની ઉપલબ્ધતાને આધીન.

^{###}ભારતમાં ફક્ત પસંદગીની શાખાઓ પર જ સેવાઓ ઉપલબ્ધ.

ઉલ્લેખિત તમામ શુલ્ક પર લાગુ પડતો માલ અને સેવા કર (ઝાંઝા) વસૂલવામાં આવશે.

^૧ભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા લેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કર) વસૂલવામાં આવશે. આ CASA ખાતા હેઠળ જારી કરાયેલા તમામ ડેબિટ કાર્ડ્સ માટે લાગુ પડે છે, સિવાય કે Elite (માસ્ટર્કાર્ડ વર્લ્ડ) અને Niyo (વિઝા પ્લેટિનમ). કૃપા કરીને નોંધ લો કે બેંકની વિવેકબુદ્ધિના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.